

25 એપ્રિલ 2018

## પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નગરપાલિકાના કૃત્રિમ મતદાનમાં (મોક વોટિંગ) ભાગ લેશે

બ્રમ્પટન, ઓન્ટારિયો – તેઓ મતદાન કરવાની વય સુધી હજું નથી પહોંચ્યા પરંતુ તેમ છતાં તેમની પાસે નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવાના મર્મનો અનુભવ કરવાની તક છે. આ મહિને સેઈન્ટ જોકિમ એલિમેન્ટરી સ્કૂલ અને આવર લેડી ઓફ પ્રોવિડન્સ એલિમેન્ટરી સ્કૂલના 150 કરતા વધુ વિદ્યાર્થીઓએ કૃત્રિમ ચૂંટણીમાં ભાગ લીધો. સીટીએ જ્યારે પોતાના અઘતન મતદાન સાધનો તપાસવા માટે બહાર પાડ્યા ત્યારે વિદ્યાર્થીઓ માટે આ ચૂંટણી અને મતદાનની પ્રક્રિયાના મહત્ત્વ વિષે વધુ ઊંડી સમજ કેળવવાની તક હતી.

નાગરિકો નગરપાલિકા સરકાર સાથે, તેઓ ઉપયોગ કરતા હોય એવી અનેક સેવાઓ મારફત જોડાયલા હોય છે, દાખલા તરીકે: પાર્ક, ટ્રાન્ઝિટ (પરિવહન), મનોરંજન, માર્ગો અને અગ્નિશમન સેવાઓ. સમુદાયમાં પોતાની ઓળખ ઉપસાવવાનો મહત્ત્વનો માર્ગ એટલે મતદાન છે.

"આજના વિદ્યાર્થીઓ આવતી કાલના મતદાતાઓ છે. મતદાન એક વિશેષાધિકાર હોવા સાથે એક જવાબદારી પણ છે, અને આપના શહેરને આકાર આપવાની મહત્ત્વપૂર્ણ રીત છે. તમે વિદ્યાર્થી હોવ કે પ્રથમ વખતના મતદાતા હોવ અથવા નવા નાગરિક હોવ કે દરેક ચૂંટણીમાં મતદાન કરતા નાગરિક હોવ ત્યારે આ યાદ રાખવા જેવી અગત્યની બાબત છે," એવું પીટર ફે, સીટી ક્લર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર એ જણાવ્યું.

### કૃત્રિમ ચૂંટણીની વિશેષતાઓ

- ઉત્સાહી વિદ્યાર્થીઓ, જે 9 થી 11 વર્ષની વયના હતા તેઓ મતદાન પ્રક્રિયા વિષે, મતપત્રક કેવું હોય અને કેવી રીતે મતપત્રક પર નિશાન કરવું તે વિષે શીખ્યા.
- કૃત્રિમ ચૂંટણી માટે, મત પત્રકમાં શહેરના વોર્ડ કેટલા છે, મતદાનનો દિવસ ક્યારે હોય અને બ્રમ્પટનમાં કેટલી ભાષાઓ બોલવામાં આવે છે તે સહિત બ્રમ્પટન વિષે મૂળભૂત પ્રશ્નો સમાયેલા હતાં.
- સ્થાનિક સરકાર વિષેના ધોરણ 5ના અભ્યાસક્રમના ભાગરૂપે બન્ને શાળાઓએ તાજેતરમાં જ બ્રમ્પટન સીટી હોલની સહેલમાં હાજર રહી હતી. જોકે હવે વધુ કૃત્રિમ ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે નહીં પરંતુ શાળાના વિદ્યાર્થીઓ માટે સીટી હોલની ટૂર ઉપલબ્ધ છે અને શિક્ષકો સીટી વેબસાઈટ પર રહેલ [ઓનલાઈન ફોર્મ](#) નો ઉપયોગ કરીને તે બુક કરાવી શકશે.
- ઓક્ટોબર 22ના રોજ થનાર નગરપાલિકાની ચૂંટણી માટે આયોજીત આશરે 75 ટકા જેટલા મતદાન કેન્દ્રો શાળાઓ હોવાથી તેઓ સીટી માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારો છે.

મતદાતાઓ માટે 5 જરૂરથી જાણવા જેવી બાબતો સીટી વેબસાઈટ પર ઉપલબ્ધ છે તેમજ વધારાની માહિતી પણ મળશે.

[www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes)મુલાકાતની મુલાકાત લો.

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

નેટલી સ્ટોગિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા (Media Coordinator)

સીટી ઓફ બ્રેમ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)